

સ્વાસ્થ્ય પ્રતિષ્ઠા કરવા માટે આ પુસ્તકને વાંચવું જરૂરી છે.

શ્રીકૃષ્ણાય નમઃ

શ્રીસર્વોત્તમ સ્તોત્ર

નો પાઠ અને ધ્યાન

તથા

શ્રી અષ્ટાક્ષર મંત્ર
ના દરેક અક્ષરનો ભાવાર્થ.

વૈષ્ણવોની કૃપાથી છપાવી પ્રસિદ્ધ કરનાર,

વૈ. જમનાદાસ હીરાચંદ ધ્રુવાડ.

મુ. મોડાસા. (જી. અમદાવાદ.)

આવૃત્તિ ૨ જી પ્રત. ૨૦

સંવત ૧૯૬૬

સન ૧૯૧૦.

અમદાવાદ—“વિજય પ્રવર્તક” પ્રિન્ટીંગ પ્રેસ.

શ્રીકૃષ્ણાય નમઃ

શ્રીકૃષ્ણાય નમઃ

સ્વાસ્થ્ય પ્રતિષ્ઠા કરવા માટે આ પુસ્તકને વાંચવું જરૂરી છે.

ગુજરાત વિધાપીઠ ગ્રંથાલય
અમદાવાદ
ગુજરાતી કોપીરાઈટ-સંગ્રહ

૨૯૪૯.

गुजरात विद्यापीठ ग्रंथालय

[गुजराती कौपीराञ्चिड विभाग]

अनुक्रमांक २८४८

वर्षांक

पुस्तकनुं नाम अन्वयोन्नाम

२-लोम

विषय ५/२२:४९०



श्रीसर्वोत्तमस्तोत्रप्रारंभः

भंगणायरक्षु.

श्रीकृष्णः शरषुभमः

श्रीकृष्णानमः श्रीगोपीजनवदललायनमः

चिंतासंतानहंतारो यत्पादांबुजरेणवः ॥

स्वीयानां तान्निजाचार्यान्प्रणमामि मुहुर्मुहुः ॥१॥

अर्थ—जेमना यरषु कभणनी रेखुओ लकतोनी चिंता अने तेना संताननी नाश करनारी छे ते अेवा श्रीमद् आचार्य (श्रीवद्वभाचार्य) ने हुं, वारं-वार प्रणाम करूं छुं.

यदनं प्रहतो जंतुः सर्वदुखागितो भवेत् ॥

तमहं सर्वदा वंदे श्रीमद्वल्लभनंदनम्.

अर्थ—जेमना अनुग्रह मात्रथीन एव सर्व प्रकारना दुःखोमांथी मुक्त थर्ष जय छे अेवा श्रीमद् वद्वभाचार्यना लाल (श्रीभुसाध श्रीविकुलनाथ) ने हुं सर्वदा वदन करूं छुं.

रदुक्तं त्नात चरणैः श्रीकृष्णःशरणंमम ॥

अत एवास्ति मच्चित्तं मंहिके पारलौकिके ॥ ३ ॥

अर्थ—श्री आचार्य महाप्रभुએ જે શ્રીકૃષ્ણઃ
શરણંમમઃ એ કહ્યું છે એજ મારા ચિત્તને આ લોકમાં
અને પરલોક વિષે નિશ્ચિંતપાણું છે.

મમ ચિત્તસ્ય વિશ્વાસઃશ્રીગોપીજન વહુભે ॥

યદા તદા કૃતાર્થોઽહં શોચનીયો ન કર્હિચિત્ ॥૪॥

અર્થ—શ્રી ગોપીજન વહુભને વિષે મારા ચિત્તને
વિશ્વાસ છે. તો જ્યારે ત્યારે હું કૃતાર્થ છું મારે કોઈ
વળતે સોચ કરવાનો નથી.

इति श्री विट्ठलेश विरचितं मंगला चरणं समाप्तम् ॥

इति श्री विट्ठलेश विरचितं भगवायरणुं समाप्तम्.

श्रीसर्वोत्तम स्तोत्र.

श्रीकृष्णाय नमः ॥ श्रीगोपीजनवल्लभाय नमः ॥

श्रीमदाचार्यचरणकमलेश्वयो नमः ॥

प्राकृतधर्मानाश्रयमप्राकृतनिखिलधर्मरूपमिति ॥

निगम प्रतिपाद्यं यत्तच्छुद्धं साकृतिस्तौमि ॥ १ ॥

प्राकृतधर्मानाश्रय प्राकृतनिखिलधर्मरूपमिति

निगम प्रतिपाद्यं यत्तच्छुद्धं साकृतिस्तौमि १

अर्थः—श्रीविठ्ठलनाथ७ ६६ छे के ७ प्राकृत

धर्मना आश्रयथी रहित अने समय अलौकीक धर्म

रूप छे. अे रीते वेदमां प्रतीपादन करेलुं, अने सा-

कार अने शुद्ध स्वरूप छे तेनी स्तुति करे छुं. १

कालिकालतमश्छन्न दृष्टित्वाद्धिदुषामपि ॥

संप्रत्यविषयस्तस्य माहात्म्यंसमभूदभूवि ॥ २ ॥

कलिकालतमश्छन्न दृष्टित्वाद्धिदुषामपि ॥

संप्रत्यविषयस्तस्य माहात्म्यंसमभूदभूवि ॥२॥

અર્થ:—માતા પુરુષોની પણ જ્ઞાન દષ્ટિ કલિકાલ-
રૂપ અંધકારથી આચ્છાદિત છે. માટે તે સ્વરૂપનું મ-
હાત્મ્ય હાલ પૃથ્વીમાં અપરિચિત થયું છે. ૨

દયયાનિજમાહાત્મ્યં કરિષ્યન્પ્રકટંહરિઃ ॥

વાણ્યાયદાતદાસ્વાસ્યં પ્રાદુર્ભુતંચકારહિ ॥ ૩ ॥

દયાનિજમાહાત્મ્યં કરિષ્યન્પ્રકટંહરિઃ ॥

વાણ્યાયદાતદાસ્વાસ્યં પ્રાદુર્ભૂતંચકારહિ ॥૩॥

અર્થ:—જ્યારે દયાવડે શ્રીહરિને પોતાના વચન-
દ્વારા પોતાનું મહાત્મ્ય પ્રકટ કરવાની ઈચ્છા થઈ
ત્યારે પોતાનું મુખાર્વિંદ પ્રાદુર્ભાવ થયું. ૩
તદૂક્તમપિદુર્બોધં સુબોધંસ્યાદથાતથા ॥

તન્નામાષ્ટોત્તરશતં પ્રવક્ષ્યામ્યાખિલાઘકૃત્ ॥ ૪ ॥

તદુક્તમપિદુર્બોધં સુબોધંસ્યાદથાતથા ॥

તન્નામાષ્ટોત્તરશતંપ્રવક્ષ્યામ્યાખિલાઘકૃત્ ॥૪॥

અર્થ:—પણ તેનું કહેલું દુર્બોધ છે માટે જેવી
રીતે સુબોધ થાય તેવી રીતે સમગ્ર પાપને હણનાર તે
શ્રીમાહાપ્રભુજીના એકસો આઠ નામ કહું છું. ૪

ऋषिरग्निकुमारस्तु नाम्नाંछंदोजगत्यसौ ॥

श्रीकृष्णास्यं देवता च बीजं कारुणिकःप्रभुः ॥५॥

ऋषिरग्निकुमारस्तु नाम्नाંछंदोजगत्यસૌ ॥

શ્રીકૃષ્ણાસ્યં દેવતા ચ બીજં કારુણિકઃ પ્રભુઃ ॥૫॥

અર્થ:—આસ્તોત્રના ઋષિ અગ્નિકુમાર છે અને જગતી છંદ છે. તથા શ્રીકૃષ્ણાસ્ય દેવતા છે અને કારુણિક પ્રભુ એ બીજ છે. ૫

વિનિયોગો ભક્તિયોગઃ પ્રતિબંધ વિનાશને ॥

કૃષ્ણાધરામૃતાસ્વાદ સિદ્ધિરત્ર ન સંસયઃ ૬ ॥

વિનિયોગો ભક્તિયોગઃ પ્રતિબંધવિનાશને ॥

કૃષ્ણાધરામૃતાસ્વાદ સિદ્ધિરત્ર ન સંસયઃ ॥૬॥

અર્થ:—અને આ સર્વોત્તમ સ્તોત્રમાં પ્રતિબંધ નાશ કરવા સાર વિનિયોગ કહેતાં પ્રયોજન ભક્તિયોગ છે. અને કૃષ્ણનું અધરામૃત સ્વાદની અહીં સિદ્ધિ છે એમાં કાંઈ સંશય નથી. ૬

આનંદઃ પરમાનંદઃ શ્રીકૃષ્ણાસ્યં કૃપાનાથિઃ ॥

દૈવોદ્ધારપ્રયત્નાત્મા સ્મૃતિમાત્રાર્તિનાશનઃ ॥ ૭ ॥

* ૧ ૨ ૩ ૪
આનંદઃ પરમાનંદઃ શ્રીકૃષ્ણાસ્યં કૃપાનિધિઃ ॥

૫
દૈવોદ્ધારપ્રયત્નાત્મા સ્મૃતિમાત્રાર્તિનાશનઃ ॥૭॥

અર્થઃ—આનંદરૂપ અને પરમાનંદરૂપ શ્રીકૃષ્ણના
મુખ્યાર્વિંદરૂપ અને કૃપાનાભંડારરૂપ અને દૈવી જીવોના
ઉદ્ધાર કરવાસાર પોતાના મનમાં યત્ન કરનારા અને
સ્મરણુ માત્રથી પીડાને નાશ કરનારા એવા શ્રી મ-
હાપ્રભુજી છે. ૭

૭
શ્રીભાગવતગૂઢાર્થ પ્રકાશનપરાયણઃ ॥

૮
સાકારબ્રહ્મવાદૈક સ્થાપકો વેદપારગઃ ॥ ૮ ॥

૭
શ્રીભાગવતગૂઢાર્થ પ્રકાશનપરાયણુઃ ॥

૮
સાકારબ્રહ્મવાદૈક સ્થાપકો વેદપારગઃ ॥ ૮ ॥

અર્થઃ—શ્રીભાગવતના ગૂઢ અર્થને પ્રકાશ કરવામાં
તત્પર એવા અને સાકાર બ્રહ્મવાદના સ્થાપન કરનારા
અને વેદને પામેલા એવા શ્રીઆચાર્ય મહાપ્રભુજી. ૮

* જે શબ્દ ઉપર ૧ થી ૧૦૮ સુધી આંકડા મુજવામાં
આવ્યા છે તે જગાએઆચાર્ય શ્રીમહાપ્રભુજીના નામસમજવાં.

१०
मायावाद निराकर्ता सर्ववादि निरासकृत् ॥

१२ १३ ११
भाक्तमार्गाब्जमार्त्तंडः स्त्रीशुद्रांघुद्धतिक्षमः ॥ ९ ॥

१०
मायावाद निराकर्ता सर्ववादिनिरासकृत् ॥

१२ १३
लक्षितमार्गाब्जमार्त्तंडः स्त्रीशुद्रांघुद्धतिक्षमः ॥ ९ ॥

अर्थ—मायावादनो निरास करनार अने सर्वे

मायावादीअने निरास करनार अने लक्षित मार्गइप
ठमलमां सूर्यइप अने स्त्रीअो तथा शुद्रादिना उद्धार
करवामां समर्थ अेवा श्रीमहाप्रभुअ. ८

१४
अंगीकृत्यैव गोपीश वल्लभीकृतमानवः ॥

१५ १६ १७
अंगीकृतौ समर्यादोमहाकारुणिको विभुः ॥ १० ॥

१४
अंगीकृत्यैव गोपीश वल्लभीकृतमानवः ॥

१५ १६ १७
अंगीकृतौ समर्यादोमहाकारुणिको विभुः ॥ १० ॥

अर्थ—अंगीकार करवाने विषे मर्यादावाणा अने
महादयालु, अने येते अंगीकार करीने गोपी पति

श्रीकृष्णभगवान्मां मनुष्येने वात्सल्य करानार जेवा
अने सर्व समर्थ श्री महाप्रभुञ्ज. १०

^{१८} अदेयदानदक्षश्च ^{१९} महोदारचरित्रवान् ॥

^{२०} प्राकृतानुकृतिव्याज मोहितासुरमानुषः ॥ ११ ॥

^{१८} अदेयदानदक्षश्च ^{१९} महोदारचरित्रवान् ॥

^{२०} प्राकृतानुकृतिव्याज मोहितासुरमानुषः ॥ ११ ॥

अर्थः—न आपी शक्य जेवां दान देवा समर्थ
जेवा, अने उदार चरित्रवाणा अने प्राकृत जनने अ-
नुसरवाना भीषेथी असुरी जनाने मोहित करनार. ११

^{२१} वैश्वानरो ^{२२} बहुभाष्यः ^{२३} सद्रूपो ^{२४} मोहितकृत्सताम् ॥

^{२५} जनशिक्षाकृतेकृष्ण ^{२६} भक्तिकृत्त्रिखिलेष्टदः ॥ १२ ॥

^{२१} वैश्वानरो ^{२२} बहुभाष्यः ^{२३} सद्रूपो ^{२४} मोहितकृत्सताम् ॥

^{२५} जनशिक्षाकृतेकृष्ण ^{२६} भक्तिकृत्त्रिखिलेष्टदः ॥ १२ ॥

અર્થ:—અત્રિથી ઉક્ત યએલા વક્ષબનામવાળા,
સારા રૂપવાળા સત્પુરુષોના હિતકારી, મનુષ્યોને શીખ-
વવા સારૂ શ્રીકૃષ્ણની ભક્તિ કરનારા સમગ્ર ઇચ્છીત
વસ્તુને આપનાર એવા શ્રીઆચાર્યજી મહાપ્રભુ છે. ૧૨

૨૭ ૨૮ ૨૯
સર્વલક્ષણસંપન્નઃ શ્રીકૃષ્ણજ્ઞાનદો ગુરુઃ ॥

૩૦ ૩૧
સ્વાનંદતુદિલંઃ પદ્મદલાયતવિલોચનઃ ॥ ૧૩ ॥

૨૭ ૨૮ ૨૯
સર્વલક્ષણસંપન્નઃ શ્રીકૃષ્ણજ્ઞાનદો ગુરુઃ ॥

૩૦ ૩૧
સ્વાનંદતુંદિલઃ પદ્મદલાયતવિલોચનઃ ॥ ૧૩ ॥

અર્થ:—સર્વ લક્ષણથી યુક્ત, શ્રીકૃષ્ણના જ્ઞાને
દેનાર, અને ગુરૂ અને પોતાના સ્વરૂપે કરીને આનં-
દવાળા, પદ્મના દલ સરખા વિશાળ નેત્રવાળા એવા
શ્રીમહાપ્રભુજી. ૧૩

૩૨ ૩૩
કૃપાદગવૃષ્ટિસંહૃષ્ટ દાસદાસી પ્રિયઃપતિઃ ॥

૩૪ ૩૫
રોપદકૃપાતસંહૃષ્ટ ભક્તાદ્વિદ્ભક્તસેવિતઃ ॥ ૧૪ ॥

૩૨ ૩૩
કૃપાદગવૃષ્ટિસંહૃષ્ટ દાસદાસી પ્રિયપતિઃ

^{३४} रोषदृष्टपातसं^{३५}लुष्ट लक्ष्मिद्वि^{३५} लक्ष्मिसेवितः ॥१४॥

अर्थः—कृपायुक्तदृष्टिश्च वृष्टिवडे शुशी यथेवा

दासदासीजनोने प्रिय, अने रोषवाणी वृष्टिवडे लक्ष्मिना
द्वेषीयेने आणी नांभनार, लक्ष्मिसेवेवा अथवा श्री

महाप्रभुश्च १४

^{३६} सुखसेव्यो ^{३७} दुराराध्यो ^{३८} दुर्लभांघ्रिसरोरुहः ॥

^{३९} उग्रप्रतापो ^{४०} वाक्सीधं ^{४१} पूरिताशेषसेवकः ॥ १५ ॥

^{३६} सुखसेव्यो ^{३७} दुराराध्यो ^{३८} दुर्लभांघ्रिसरोरुहः ॥

^{३९} उग्रप्रतापो ^{४०} वाक्सीधं ^{४१} पूरिताशेषसेवकः ॥१५॥

अर्थः—सुखे करीते शेववा योग्य, दुःखे करीते

आराधना करवा योग्य, जेवना अर्जुंशी कमल दुर्ल-

भा छे, उग्र प्रतापवाणी, वाणीश्च अमृतवडे समग्र

सेवकाने पूर्युं करनार. १५

^{४२} श्री भागवतपीयूष समुद्रमथनक्षमः ॥

^{४२} तत्सारभूतरासस्त्री भावपूर्णतविग्रहः ॥ १६ ॥

४१
श्रीभागवतपीयूष समुद्र भयनक्षमः ॥

४२
तत्सारभूतरासस्त्री भावपूरितविग्रहः ॥ १६ ॥

अर्थः—श्रीभागवतश्च अमृतनो समुद्र तेनी कथा
करवाभां समर्थ अने ते भागवतने विषे सारभूत स्त्री
रासकीय स्त्रीभावे करी परिपूर्णु देहवाणा. १६

४३ ४४
सान्निध्यमात्रदत्त श्रीकृष्णप्रेमाविमुक्तिदः ॥

४५ ४६
रासलीलकतात्पर्यः कृपयैतत्कथाप्रदः ॥ १७ ॥

४३ ४४
सान्निध्यमात्रदत्त श्रीकृष्णप्रेमाविमुक्तिदः ॥

४५ ४६
रासलीलकतात्पर्यः कृपयैतत्कथाप्रदः ॥ १७ ॥

अर्थ—पोतानी सान्निधि मात्रमां श्रीकृष्णने विषे
प्रेमनुं दान करनार अेवा अने मुक्तिने हेतारा रास-
लीलामां अेक तात्पर्यवाणा अने कृपाअे करीने अे
श्रीकृष्णनी कथाने हेतारा. १७

४७
विरहानुभवैकार्य सर्वत्यागोपदेशकः ३

^{४८} भक्त्याचारोपदेष्टा च ^{४९} कर्ममार्गप्रवर्तकः ॥ १८ ॥

^{४७} विरहानुभवैकार्थं सर्वत्यागोपदेशकः ॥

^{४८} भक्त्याचारोपदेष्टाय ^{४९} कर्ममार्गप्रवर्तकः ॥ १८ ॥

अर्थः—केवण विरहना अनुभव साऽ सर्व त्यागनो
उपदेश करनारा भक्ति वास्ते आचारनो उपदेश करनारा,
अने कर्ममार्गने प्रवर्तावनारा एवा श्रीआचार्यञ्च. १८

^{५०} यागादौ भक्तिमार्गिकसाधनत्वोपदेशकः ॥

^{५१} पूर्णानंदः ^{५२} पूर्णकामो ^{५३} वाक्पतिर्विष्णुधेश्वरः ^{५४} ॥ १९ ॥

^{५०} यागादौ भक्तिमार्गिकसाधनत्वापदेशकः ॥

^{५१} पूर्णानंदः ^{५२} पूर्णकामो ^{५३} वाक्पतिर्विष्णुधेश्वरः ^{५४} ॥ १९ ॥

अर्थः—यागादि कर्ममां भक्ति मार्गानुंज अक
स. । नपणुं छे एवो उपदेश करनार पूर्ण आनंदवाणा,
पूर्ण कामवाणा, वाक्पतिना अधिपति, विष्णुधना धेश्वर
एवा श्री आचार्यञ्च. १९

५५ ५४
 कृष्णनामसहस्रस्यवक्ताभक्तिपरायणः ॥

५७
 भक्त्याचारोपदेशार्थनानावाक्यनिरूपकः ॥ २० ॥

५५ ५४
 कृष्णनामसहस्रस्यवक्ताभक्त्यापरायणः ॥

५७
 भक्त्याचारोपदेशार्थनानावाक्यनिरूपकः २०॥

अर्थ—श्रीकृष्णनामसहस्रनामने कडेनारा अने भक्तोने शरणाग्र अने भक्ति तथा आचारना उपदेश आरु नाना प्रकारना वाक्यने निरूपण करनारा अेवा. २०

५८ ५६
 स्वार्थोज्झिताखिलप्राणप्रियस्तादृशचेष्टितः

६० ६१
 स्वदासार्थकृताशेषसाधनः सर्वशक्तिधृक् ॥ २१ ॥

५८ ५६
 स्वार्थोज्झिताखिलप्राणप्रियस्तादृशचेष्टितः ॥

६० ६१
 स्वदासार्थकृताशेषसाधनः सर्वशक्तिधृक् ॥ २१ ॥

अर्थ—श्रीआचार्यने अर्थे अखिल प्राणने अर्पण करनार पुरुषोने प्रिय अेवा अने तेवा तादृशी पुरुषोअे वीटाअेला अने पोताना दासने सारु समग्र

साधन करनार अने सर्व शक्तिने धारणु करनार अेवा
श्री आचार्य७. २१

^{६२} भुविभक्तिप्रचारैककृते ^{६३} स्वान्वयकृत्पिता ॥

^{६४} स्ववंशस्थापिताऽशेषस्वमाहात्म्यः ^{६५} स्मयापहः ॥२२॥

^{६२} भुविभक्तिप्रचारैककृते ^{६३} स्वान्वयकृत्पिता ॥

^{६४} स्ववंशस्थापिताऽशेषस्वमाहात्म्यः ^{६५} स्मयापहः ॥२२॥

अर्थ—पृथ्वीमां केवण भक्तिने प्रचार करवा
साऽ पोतानो वंश करनार अने पिताऽप अने पोताना
वंशने विषे पोताना समग्र महात्म्यनुं स्थापन करनार
अने गर्वने नाश करनार अेवा श्रीमहाप्रभु. २२

^{६६} पतिवृतापतिः ^{६७} पारलौकिकै हिकदानकृत् ॥

^{६८} निगूढहृदयोऽनन्यभक्तेषुज्ञापिताशयः ^{६९} २३ ॥

^{६६} पतिवृतापतिः ^{६७} पारलौकिकै हिकदानकृत् ॥

^{६८} निगूढहृदयोऽनन्यभक्तेषुज्ञापिताशयः ^{६९} ॥२३॥

અર્થ:—પતિવૃતાઓના પતિ અને પરબ્રોહ્મ તથા આ લોક સંબંધી દાન કરનાર અને ગૂઢ હૃદયવાળા અનન્ય ભક્તોમાં પોતાનું અંતઃકરણ જણાવનાર. ૨૩.

૭૦
ઉપાસનાદિ માર્ગાતિમુગ્ધમોહ નિવારકઃ ॥

૭૧
ભક્તિમાર્ગે સર્વમાર્ગવૈલક્ષણ્યાનુભુતિકૃત્ ॥ ૨૪ ॥

૭૦
ઉપાસનાદિ માર્ગાતિમુગ્ધમોહ નિવારકઃ ॥

૭૧
ભક્તિમાર્ગે સર્વ માર્ગ વૈલક્ષણ્યાનુભુતિકૃત્ ૨૪

અર્થ:—ઉપવાસનાદિ માર્ગોમાં અતિ મુગ્ધ પુર-
ષોના મોહને મટાડનાર ભક્તિ માર્ગને વિષે સર્વ મા-
ર્ગથી વિલક્ષણ રીતે અનુભવ કરનાર એવા. ૨૪

૭૨
પ્રથક્કૃષ્ણમાર્ગોપદેષ્ટા શ્રી કૃષ્ણહાર્દવિત્ ॥

૭૪
પ્રતિક્ષણનિકુંજસ્થલીલાસસુપૂરિતઃ ॥ ૨૫ ॥

૭૨
પ્રથક્કૃષ્ણમાર્ગોપદેષ્ટા શ્રીકૃષ્ણહાર્દવિત્ ॥

૭૪
પ્રતિક્ષણ નિકુંજસ્થલીલાસસુપૂરિતઃ ॥૨૫॥

અર્થ:—ગુદી રીતે શરણુ માર્ગનો ઉપદેશ કરનાર, શ્રીકૃષ્ણના હાદને જાણનાર, ક્ષણે ક્ષણે નિકુંજમાં થએલી લીલાના રસે કરીને પરિપૂર્ણ એવા ૨૫

^{૭૫} તત્કથાક્ષિપ્તચિત્તસ્તદ્વિસ્મૃતાન્યો ^{૭૬} વ્રજપ્રિયઃ ^{૭૭} ॥

^{૭૮} પ્રિયવ્રજ સ્થિતિઃ ^{૭૯} પુષ્ટિલીલાકર્તારહઃ ^{૮૦} પ્રિયઃ ॥૨૬॥

^{૭૫} તત્કથાક્ષિપ્તચિત્તસ્ત ^{૭૬} દ્વિસ્મૃતાન્યો ^{૭૭} પ્રજપ્રિયઃ ॥

^{૭૮} પ્રિયવ્રજ સ્થિતિઃ ^{૭૯} પુષ્ટિલીલાકર્તારહઃ ^{૮૦} પ્રિયઃ ૨૬

અર્થ:—તે નિકુંજવનમાં શ્રીકૃષ્ણચંદ્ર સંબંધી રાસલીલા કથા વડે ચિત્તને ખેંચનાર અને તે કથા કરવા સારૂ અન્ય કથા વિરોધી કાર્યને વિસ્મરણ કરાવનાર અને વ્રજમાં પ્રીતિવાળા અને પ્રિય વ્રજમાં સ્થિતિવાળા અને પુષ્ટિ સંબંધી રાસલીલા કરનાર અને એકાંતિક ભક્તિમાં પ્રીતિવાળા શ્રીઆચાર્યજી. ૨૬

^{૮૧} ભક્તચ્છાપૂરકઃ ^{૮૨} સર્વાજ્ઞાતલીલો ^{૮૩} ઈતિમોહનઃ ॥

^{૮૪} સર્વાસક્તો ^{૮૫} ભક્તમાત્રાસક્તઃ ^{૮૬} પતિતપાવનઃ ॥૨૭॥

^{૮૧} ભક્તેઽઞ્ચાપૂરકઃ ^{૮૨} સર્વાજ્ઞાતલીલોડ્ઽતિભોહનઃ ॥ ^{૮૩}

^{૮૪} સર્વાસકતો ^{૮૫} ભક્તમાત્રાસકતઃ ^{૮૬} પતિતપાવનઃ ૨૭

અર્થઃ—ભક્તની ઇચ્છાને પૂર્ણ કરનારા બ્રહ્મા
સર્વે પુરૂષોને અજ્ઞાત છે લીલો જેની એવા અને અ-
ત્યંત મોહ કરનાર સર્વને વિષે આસક્તિ રહિત, અને
કેવળ ભક્તને વિષે આસક્ત, અને પતિત પુરૂષોને પ-
વિત્ર કરનારા, એવા શ્રીઆચાર્યજી. ૨૭

^{૮૭} સ્વયશોગાનસહૃષ્ટ હૃદયાંભોજવિષ્ટરઃ ॥

^{૮૮} યશઃપીયૂષલહરીપ્લાવિતાન્યરસઃ ^{૮૯} પરઃ ॥ ૨૮ ॥

^{૯૦} સ્વયશોગાનસંહૃષ્ટ હૃદયાંભોજવિષ્ટરઃ

^{૯૧} યશઃપીયૂષલહરી ^{૯૨} પ્લાવિતાન્યરસઃ ^{૯૩} પરઃ ૨૮

અર્થઃ—પોતાનો જશ ગાવાથી પ્રસન્ન થયેલાં ભ-
ક્તના હૃદયરૂપ કમલમાં આસન કરનાર, યશરૂપ અમૃ-
તની લહેરથી ભીંજવેલ છે અન્ય રસ જોશે એવા,
અને શ્રેષ્ઠ એવા શ્રીમહાપ્રભુજી. ૨૮

^{६०} लीलामतरसार्द्रार्द्रां कृताखिलशरीरभृत् ॥

^{६१} गोवर्द्धनस्थित्युत्साहस्तल्लीलांप्रेमपूरितः ॥ २९ ॥

^{६०} लीलाभृतरसार्द्रार्द्रां कृताखिलशरीरभृत् ॥

^{६१} गोवर्द्धनस्थित्युत्साहस्तल्लीलांप्रेमपूरितः २९

अर्थः—लीलाभृत् अमृत संबंधी रसार्द्र भाव-
वडे सङ्ग शरीरधारीने रसवाणा ठरनार, अने श्री-
गोवर्द्धन गिरिशन्नी स्थितिमां उत्साहवाणा अने ते
भगवद् लीलाभां प्रेमरस वडे परिपूर्णु अेवा, श्रीम-
हाप्रभुः २९

^{६३} यज्ञभोक्ता ^{६४} यज्ञकर्त्ता ^{६५} चतुर्वर्ग विशारदः

^{६६} सत्यप्रतिज्ञस्त्रिगुणातीतो ^{६७} नयविशारदः ॥ ३० ॥

^{६३} यज्ञभोक्ता ^{६४} यज्ञकर्त्ता ^{६५} चतुर्वर्ग विशारदः ॥

^{६६} सत्यप्रतिज्ञस्त्रिगुणातीतो ^{६७} नयविशारदः ॥३०॥

अर्थः—यज्ञ भोक्ता अने यज्ञ कर्त्ता, तथा धर्म,
अर्थ, काम अने मोक्षने देव भां उहापशुवाणा, मायी

प्रतिज्ञावाणा, त्रयु गुणुथी रूडित अने नीतिमां यतुर
 अेवा श्रीआचार्यः - ३०

६६ १००
 स्वकीर्तिवर्द्धनस्तत्त्वसूत्रभाष्यप्रदर्शकः ॥

१०१ १०२
 मायावादाख्यतूलाग्नि ब्रह्मवाद निरूपकः ॥ ३१ ॥

६६ १००
 स्वकीर्तिवर्द्धनस्तत्त्वसूत्रभाष्य प्रदर्शकः ॥

१०१ १०२
 मायावादाख्यतूलाग्नि ब्रह्मवाद निरूपकः ३१

अर्थः—पोतानी कीर्तिने वधारनार अने सां
 ष्य, तत्व, अने व्यास सूत्रना भाष्यने करनार अने
 मायावादरूप कपासमां अग्नि सरणा अने ब्रह्मवादाने
 निरूपणु करनारा अेवां श्रीआचार्यः, ३१

१०३ १०४
 अप्राकृताऽखिलाकल्पभूषितः सहज स्मितः ॥

१०५ १०६ १०७
 त्रिलोकी भूषणं भूमिभाग्यं सहजसुंदरः ॥ ३२ ॥

१०३ १०४
 अप्राकृताऽखिलाकल्पभूषितः सहज स्मितः ॥

१०५ १०६ १०७
 त्रिलोकी भूषणं भूमिभाग्यं सहजसुंदरः ३२

અર્થ:—અત્રૈકિક સર્વ શૃંગારવડે શુશોભિત અને સહજ હાસ્યવાળા ત્રણ લોકમાં ભૂષણ સરખા અને પૃથ્વી ના ભાગ્યરૂપ, અને સહજ સુંદર એવા શ્રીમહા પ્રભુજી ૩૨

૧૦૮

અશેષભક્તસંપ્રાર્થ્યચરણાબ્જરજોધનઃ ॥

ઇત્યાનંદનિધેઃ પ્રોક્તં નામ્નામષ્ટોત્તરંપતનં ॥ ૩૩ ॥

૧૦૯

અશેષભક્તસંપ્રાર્થ્યચરણાબ્જરજોધનઃ ॥

ઇત્યાનંદનિધેઃ પ્રોક્તં નામ્નામષ્ટોત્તરંપતનં ૩૩

અર્થ:—જેના ચરણકમળના રજરૂપી ધન અ-
શેષ ભક્તજનોએ સંપ્રાર્થનીય છે (એટલે સારી
રાતે ધ્યાન કરવા યોગ્ય છે) એવા શ્રીઆચર્યજી મ-
હાપ્રભુજી છે એ પ્રમાણે આનંદના સમુદ્રરૂપ શ્રીમહા-
પ્રભુજીનાં એકસો અને આઠ નામ ઠહ્યાં. ૩૩

શ્રદ્ધા વિશુદ્ધ બુદ્ધિર્યપઠત્યનુદિનં જનઃ ॥

સતદેકમનાઃસિદ્ધિમુક્તાં પ્રાપ્નોત્ય સંશયમ્ ॥૩૪॥

શ્રદ્ધાવિશુદ્ધબુદ્ધિર્યપઠત્યનુદિનં જનઃ ॥

સતદેકમનાઃસિદ્ધિમુક્તાંપ્રાપ્નોત્યસંશયમ્૩૪

અર્થ:—શ્રદ્ધાવડે વિશુદ્ધ બુદ્ધિવાળો જે મનુષ્ય હ્રમેશાં તેને વિષે નિશ્ચય મનવાળો થઈને આ સ્તોત્રનો પાઠ કરે, તો તે પુરૂષ કહેણી મહા સિદ્ધિને પ્રાપ્ત થાય એમાં કાંઈ શંકા નથી. ૩૪

તદપ્રાપ્તૌવૃથામોક્ષ સ્તદાપ્તૌતદ્ગતાર્થતા ॥

અતઃ સર્વોત્તમં સ્તોત્રં જપ્યં કૃષ્ણરસાર્થિભિઃ ॥૩૫॥

તદપ્રાપ્તૌવૃથામોક્ષ સ્તદાપ્તૌતદ્ગતાર્થતા ॥

અતઃ સર્વોત્તમં સ્તોત્રં જપ્યં કૃષ્ણરસાર્થિભિઃ ૩૫

અર્થ:—તે શ્રીઆચાર્યજીની પ્રાપ્તિ વિના મોક્ષ પણ વૃથા છે અને તે સ્વમાર્ગ સંબંધી ફળની પ્રાપ્તિ થાય તો સાયુજ્યાદિક મોક્ષનું પણ નિર્રથકપણું છે એ વાસ્તે આ સર્વોત્તમસ્તોત્રથી શ્રીકૃષ્ણચંદ્ર૩૫ રસની ઇન્ધાવાળા પુરૂષોએ જપ કરવા યોગ્ય છે. ૩૫

॥ इति श्रीमदाग्नेकुमार प्रोक्तं ॥

॥ सर्वोत्तम स्तोत्रं समाप्तं ॥

ઈતિશ્રીમદ્ અગ્નિ કુમાર પ્રોક્તં સર્વોત્તમસ્તોત્ર સંપૂર્ણું.

અથ શ્રી સર્વોત્તમજીનું

ધોળ.

ભલે પ્રગટયા શ્રી વલ્લભદેવ,
 પુરુષોત્તમ ભૂતલ કરીજી,
 નહી પ્રાકૃત ધર્મનો લેશ,
 અપ્રાકૃત નિજવપુ ધરીજી. ૧

કરે નિગમ નિરૂપણ એમ,
 તે સાકારની રતુતિ કરીજી,
 મહાકળિ કાળાદિક દોષ,
 પંડિતદૃષ્ટિમિર ભરીજી. ૨

મહિમા નવ જાણે જેહ,
 તે કહીએ ખરા સુરહરિજી,
 વહાલે દયા કરી મુખરૂપ;
 નિજવીલા પ્રગટ કરીજી. ૩

જેની વાણી અતિ દુર્ગોધ,

થાયે સુખોધ જેને કરીજી,
તેના અષ્ટોટર શતનામ,
તે કહીએ મહા અધહરીજી. ૪

જેના ઋષિવર અગ્નિકુમાર,
જપતી છંદ નામે ધરીજી;
શ્રીકૃષ્ણ કમળ સુખદેવ,
ખીજ દષ્ટિ કરૂણા ભરીજી. ૫

જેની ભક્તિમાં અંતરાય,
તે નાશને પ્રયોજન સહીજી,
આપે અધરામૃતથી સિદ્ધિ,
તે મધ્યે નિશ્ચયે કરીજી. ૬

ઠાળ.

વહાલો *આનંદ^૧ પરમાનંદ^૨ કહેવાય,

* જે શબ્દ ઉપર ૧ થી ૧૦૮ સુધી આંકડા મુકવામાં આન્યા છે તે જગાએ આચાર્ય શ્રીમહાપ્રભુજીના નામે સમજવાં.

श्रीकृष्ण^३ कमल मुञ्ज कृपानिधि^४ थाय. ७

पहालो^५ देवी उद्धारणु प्रयत्न उपाय,

जेना स्मरण^६ मात्रथी अति जय. ८

श्रीभागवत^७ गुढार्थ प्रगटाय,

साकार^८ अह्नो वाह स्थपाय. ९

वेद^९ पारंग शैह भुवन कडेवाय,

माया^{१०} वाह निराकृत सहुमीलि गाय. १०

सर्व^{११} वाहि निरास कीधा ते लभाय,

भक्ति^{१२}मार्ग सरस कमल विकसाय. ११

श्री^{१३} शुद्रादिकने उद्धारवा समर्थ,

जेना साधन^{१४} अणथी न थाय अर्थ. १२

अंगीकार^{१४} मात्रथी सर्व स्वकीय,

- કીધા શ્રીગોપીજન પતિને પ્રિય. ૧૩
- ^{૧૫} અંગીકાર કરે મર્યાદાનું સાર,
^{૧૬} મહાકરુણાવંત ^{૧૭} સમર્થ અપાર. ૧૪
- વહાલો અદ્વેયદાન દેવાને ચતુર,
^{૧૮} મહાઉદાર ચરિત્ર કરે બહુ પૂર. ૧૫
- લીલા દેખાડી પ્રાકૃત^{૨૦}ની જેહ,
 તે મિષે મોઘ સુર રિપુ તેહ. ૧૬
- વૈશ્વાનર* ^{૨૧} શ્રીવલ્લભ ^{૨૨} છે નામ,
^{૨૩} વહાલો સુંદરરૂપ ^{૨૪} સ્વજન હિતકામ. ૧૭
- ^{૨૫} કૃષ્ણ ભક્તિ કરે જન શિક્ષાકાજ,
^{૨૬} આપે અખિલ ઇષ્ટ શ્રીવલ્લભરાજ. ૧૮

^{२७}
सर्व लक्षणयुथी संपन्न विवेक,

^{२८} श्रीकृष्णु ज्ञान दाता ^{२८} गुरु एक.

१८

पोताना आनंद थकी जहु पुष,

^{३१}
अना कमण पत्रसे नेत्र संतुष्ट.

२०

^{३२}
कृपा दृष्टिनी वृष्टिथी हरज्यां मन,

^{३३}
ते दास दासी त्रिय पति ने अनन्य. २१

^{३४}
रोष दृष्टि करे अक्षित शत्रु *अजण,

^{३५}
अकत सेवांता सुअ सेवा रसाण. २२

^{३६}
अरे अक्षित विना नही सेवा साध्य,

^{३७}
ते कारण्युथी कहीअे + दुराराध्य. २३

^{૩૮}
જેના ચરણ સરોજ હૃલ્લભ દરસાય,

^{૩૯}
તેના ઉચ્ચ પ્રતાપ ત્રૈલોક કહેવાય. ૨૪

^{૪૦}
વચનામૃત કરી પૂર્યા સેવકના અર્થ,

^{૪૧}
શ્રીભાગત અમૃત મથન સમર્થ. ૨૫

^{૪૨}
તેનો સાર કહીયે પ્રજા સુંદરીનો ભાવ,

તે પરિપૂર્ણ છે દેહુ ભરાવ. ૨૬

^{૪૩}
સાન્નિધ્ય માત્ર કરે કૃષ્ણ પ્રેમ,

^{૪૪}
ભક્તિ મુક્તિ દેવાનું એહુને નેમ. ૨૭

^{૪૫}
એક રાસલીલામાં તેમનું તાન,

^{૪૬}
પ્રભુ કૃપા કરીને કરે કથાનું દાન. ૨૮

^{૪૭}
વહાલો વિરહના અનુભવને હિતે કાજ,

સર્વ ત્યાગ જણાવ્યો શ્રીવલ્લભરાજ. ૨૯

- ઉપદેશ કર્યો ભક્તિમાર્ગ આચાર,
લોક માંહે કર્યો કર્મે માર્ગ પ્રચાર. ૩૦
- વેદ શાસ્ત્ર કહ્યા યજ્ઞાદિક દાન,
તેનું કૃણ મર્યાદા ભક્તિ નિદાન. ૩૧
- પ્રભુ પૂર્ણાનંદ છે પૂરણુ કામ,
સરસ્વતિના પતિદેવઈશઃશઃશ્રમિરામ +૩૨
- વહાલો સહસ્ર કહ્યાં પુરુષોત્તમ નામ;
નિજ જનને આશ્રયનું છે ધામ. ૩૩
- ભક્તિ માર્ગની રીતે કરવા ઉપદેશ,
બહુ ગ્રંથ કરીને ટાળ્યો સંશયનો લેશ. ૩૪
- જેને પામવાન છોડ્યા પ્રાણુથી પ્રિયે,
એવા ભક્ત સમાજ બિરાજે શ્રીએ. ૩૫

આપ સાંધન કરે નિજ હાસને કાજ,^{૬૦}

એવા સમર્થ શ્રીવલ્લભ મહારાજ,^{૬૧} ૩૬

કરવા ભક્તિ પ્રચાર ભૂતલ માંહી,^{૬૨}

વંશ કીધા પિતા થઇને ગ્રહી બાંહી.^{૬૩} ૩૭

સર્વે સામર્થ ધર્યું પોતાને વંશ,^{૬૪}

ગર્વ દૂર કરી ટાળ્યો સંશયનો અંશ ૩૮^{૬૫}

પ્રભુ પતિવૃતાના પતિ સાક્ષાત.^{૬૬}

કરે ચહલોક પરલોક દાન વિખ્યાત.^{૬૭} ૩૯

જેના અંતઃકરણ છે ગૂઢ અપાર.^{૬૮}

અંગીકૃત્યને જણાવ્યો મનનો વિચાર.^{૬૯} ૪૦

ઉપાસનાંદિક માર્ગ જે અન્ય;
તેનો મોહ ટાળીને કીધા સેવક અનન્ય. ૪૧

કર્યો નિશ્ચયે જે ભક્તિ સર્વથી વિશેષ,
કીધો શરણ માર્ગનો જીવો ઉપદેશ. ૪૨

શ્રીકૃષ્ણના મનની જાણે વાત,
લીલાકુંજખિહારી પરિપૂર્ણ ગાત. ૪૩

કથારસ મગ્ન સદા છે ચિત્ત,
વિસર્જ્યુ શૌ તે થકી બીજું વિત્ત. ૪૪

પ્રિય છે ઘણું પ્રજને પ્રજનો વાસ,
કરે પુષ્ટિ લીલા એકાંત વિલાસ. ૪૫

કરે ભક્તેચ્છા પરિપૂર્ણ દાન,
નહી નિજ લાલોનું કોઈને જ્ઞાન. ૪૬

અતિ મોહિત જેનું શીલ ધણું,
 નહિ લોક વિષે આસક્તિ આણું. ૪૭

નિજ લક્ષ્ય વિષે આસક્તિ છે એક,
 પ્રભુ પાવન કીધા પતિત અનેક. ૪૮

જે કરે પોતાના ગુણનું ગાન,
 તેના હૃદય કમળ રહેવાનું સ્થાન. ૪૯

નીજ યશરૂપ અમૃત લહેરી;
 તેથી ભીંજવી સર્વ રસ વાસના હુરિ. ૫૦

પ્રભુ પોતે સર્વ થકી છે પર,
 ન કરે તુલ્યતા કોઈ અવર. ૫૧

લીલારસ અમૃત તરંગ બહુ,
 ભીંજવ્યા છે લક્ષ્ય શરીર સહુ. ૫૨

૨૧
રૂચિ આપે ગિરિગૌવર્દન વાસ,

૨૨
તે લીલામાં છે અતીશે ઉદ્ધાસ. ૫૩

૨૩
કરે યજ્ઞ ભોગ ને યજ્ઞ કર્મ,

૨૪
આપે અર્થ કામ ને મોક્ષ ધર્મ. ૫૪

૨૫
પ્રભુ સત્ય વચન છે *ત્રિગુણાતીત,

૨૬
નીતિ ચતુરાઇ છે અતિ અગણિત. ૫૫

૨૭
કરવા પોતાની કીર્તિ પ્રકાશ્ય,

૧૦૦
કર્ચું વ્યાસ સૂત્રનું નૂતન ભાષ્ય. ૫૬

૧૦૧
અતિ તુચ્છ તૂલ જે માયાવાદ,

૧૦૨
કરી ભસ્માન્નિ થાયો પ્રહ્લવાદ. ૫૭

૧૦૩
અપ્રાકૃત ભુવણુની અતિ કાંતિ,

- હસતાં મુખ શોભે છે બહુ ભાંતિ. ૫૮
- પ્રભુ તિનં લોકના ભૂષણ સાર,
પ્રગટયા ધરણીનું ભાગ્ય અપાર. ૫૯
- પ્રભુ સુંદરતા છે અતિ અનૂપ,
કેમ વર્ણન કરી શકું એ સ્વરૂપ. ૬૦
- સૌ માગે છે પોતાના જન,
અરણ્યાવિંદની રજ જે ધન. ૬૧
- એ કદ્યાં એકસોને આઠે નામ,
શ્રીવલ્લભ આનંદનું છે ધામ. ૬૨

વલણ.

- જે કેાઈ શ્રદ્ધા કરી નિત્ય ગાયેરે,
તેનું મન પહેલું સ્થિર થાયેરે. ૬૩
- અધરામૃતની સિદ્ધિ પામેરે,

- તેમાં સંશયનું નહીં નામરે. ૬૪
- એ પામ્યા વિના મોક્ષ છે હીનરે,
તેના કૃળમાં મુક્તિ છે લીનરે. ૬૫
- તેથી સર્વોત્તમ જપ કરવોરે,
શ્રીકૃષ્ણ રસ મન ભરવોરે ૬૬
- શ્રીવિકૃલ *ઉચરિત એ નામરે,
જે ગાય પૂરે તેના કામરે, ૬૭
- તેનો જન્મ સકળ કરી લેખેરે,
શ્રી વ્રજ ભૂષણુ સુખ દેખેરે. ૬૮

ઇતિ શ્રી સર્વોત્તમજનું ઘોળ સમાપ્ત.

શ્રીઅષ્ટાક્ષરમંત્રના દરેક

અક્ષરનો ભાવાર્થ.

શ્રી કૃ ષ્ણ શ ર ણ મ મ

- ૧ શ્રી ના ઉચ્ચારથી સર્વ સૌભાગ્યે પ્રાપ્ત થાય છે. લૌકિક અલૌકિક ધન પ્રાપ્ત થાય છે, અને સર્વ પ્રકારનું લૌકિક અલૌકિક રાજવલ્લભ પ્રાપ્ત કરાવે છે.
- ૨ કૃ ના ઉચ્ચારથી પાપ માત્ર શોષાઈ જાય છે.
- ૩ ષ્ણ ના ઉચ્ચારથી તાપ માત્ર નાશ પામે છે.
- ૪ શ ના ઉચ્ચારથી યોનિ દાહ પામે છે, જન્મનું મૂલજ શાંત થઈ જાય છે. અપુનરાવૃત્તિ સિદ્ધ થાય છે.
- ૫ ર નો ઉચ્ચાર અગ્નિ ખીજ હોવાથી, અલૌકિક અગ્નિનો પ્રવેશ થવાથી, પરા ભગવદ્વિદ્યા ભગવત સ્વરૂપ જ્ઞાન થઈ જાય છે.
- ૬ ણ ના ઉચ્ચારથી પરમ નિર્વૃત્તિરૂપ પરમ સુખરૂપ

પરમાનંદરૂપ શ્રીકૃષ્ણભુમાં નિરંતર સુદૃઢ ભક્તિ સિદ્ધ થાય છે.


૭ મ ના ઉચ્ચારથી શ્રીકૃષ્ણરૂપ રત્નના દાન કરનાર ઉપદેશ કરનાર ગુરૂ વિષે પ્રીતિ પ્રકટ થાય છે.

૮ મ ઉચ્ચારથી હરિમાં સાયુજ્ય જાઇ જાય છે એટલે સર્વથા પુનર્જન્મ થતો નથી.

આ પ્રમાણે શ્રી અષ્ટાક્ષર મહા મંત્રનો અર્થ અવગાહન કરી જપ કરે તો જ્ઞાન રહિત જીવોને પણ તારનાર શ્રી વિદુલ પ્રભુમાં આશક્તિ થાય છે, ભક્તિ પ્રાપ્ત થાય છે વૈરાગ્ય સિદ્ધ થાય છે. ભક્તિ અને મુક્તિ ઉભયે નિરંતર એના કરમાં રહે છે, અષ્ટાક્ષર મંત્રના અર્થ વિચારપુર્વક જપ કરનારના સર્વ રોગ શાંત થઈ જાય છે, સર્વ પાપ નિવૃત્ત થઈ જાય છે, તેના ધરમાં સત્વર સ્થિર રિદ્ધિ સર્વદા નિવાસ કરે છે. આનંદ, પરમાનંદ હરિ પ્રિય સાયુજ્ય પ્રાપ્ત થાય છે, સર્વ જ્વરવિનાશક શ્રીકૃષ્ણ મંત્રનો જપ, ભૂત પ્રેત, પિશાચ, વ્યાધિ, ચૌર આદિ સંકટમાં કરવામાં આવે તો તે સર્વ ભીતિ નિવૃત્ત થઈ જાય છે, સર્પને જો

ધને જેમ ઉંદર શાંત થઈ જાય છે. તેમ શત્રુ શાંત
 થઈ જઈ મિત્ર થઈ જાય છે અષ્ટાક્ષર મહામંત્રના
 જપથી સર્વ કુ ક્રિયા, કુગ્રહ, સર્વ અરિષ્ટનો નાશ
 થઈ જાય છે એના હૃદયમાં જ્ઞાનંદ મૂર્તિ કૃષ્ણ નિ-
 રંતર નિવાસ કરે છે. દુઃખ નિવારણ, સદા સર્વદા
 સુખ પ્રાપ્ત થાય છે, નિરંતર એ મહામંત્રનો અહોરાત્ર
 જપ કરવો ગુરૂનાં ગુપ્ત રહસ્યાર્થનો સાક્ષાત્કાર કરાવ-
 નાર એ મહામંત્ર છે. એવા ભક્તનાં દર્શન માત્રથી
 મનુષ્ય લોક પવિત્ર થઈ જાય છે. સર્વ મંત્રમાં એ
 મહામંત્ર હોવાથી મંત્રરાજ કહેવાય છે, ઉત્તમોત્તમ
 મત્ર કહેવાય છે, પરમ અનન્ય ભક્તે નિરંતર આ-
 મંત્રનું સ્મરણ કરવું. સ્મરણથી નિરંતર રિક્તિ ગૃહમાં
 સિદ્ધિરૂપ થઈને રહે છે, ઉત્તમોત્તમ ભક્તે નિશ્ચય સ-
 મજવું કે એ મંત્રનું સુંદર તાત્પર્ય શ્રીકૃષ્ણજ છે.
 અને એ મંત્ર ભક્તનો પરમ હિતકારક છે. જેમ
 વેદ વાક્યમાં, પુરાણમાં, ભારતમાં, મહાવાક્ય હોય છે
 એજ પ્રમાણે શ્રીમદ્ વલ્લભાચાર્યના વચનોમાં અષ્ટાક્ષર

મહા વાક્ય છે વેદ વાક્યે મહાવાક્યં પુરાણે
 ભારતે તથા શ્રી મહાહુમવાક્યાર્થ શ્રી કૃષ્ણઃ
 શરણં મમ. । જેમઃ, સર્વ ંયોનું તાત્પર્ય તે તે
 ંયોના મહાવાક્યમાં હોય છે તેમજ શ્રીમદ્ વલ્લભાચા-
 ર્યજ્ઞના સમસ્ત વાક્યોનું તાત્પર્ય અષ્ટાક્ષર મહા-
 મંત્રજ છે.



બહેર ખગર.

૧ મક્તિ માર્ગનું રહસ્ય ॥ શ્રીમદ્ જોર
રાજે તરફથી મુંબઈમાં અને ખૂબ સ્થળે
વિષે અપાયેલાં ધણાંજ રસિક આપ્યાને
ર. ૦-૫-૦ પાકું પુંડું સોનેરી નામ સાથેના *

૨ શ્રી કોટયર્ક તિર્થ અને સ્વચ્ચાયત
કોટયર્કજીનું પ્રાગટ્ય માહાત્મ્ય અને ખડાયા
ઉત્પત્તિ પ્રકરણ તથા આ જ્ઞાતિની વસ્તિ
જ્ઞાતિને લગતી સુધારાની ચર્ચા વગેરેનું વિવેચન.
મત ર. ૧-૮-૦.

આ બંને પુસ્તકો માટે વિદ્વાનોના ઉત્તમ *
ભિપ્રાય મળેલા છે.

પ્રસિદ્ધ કર્તા—મુળજી નાથજી કોઠારી.
મળવ.નું ઠેકાણું.

મુંબઈની પંચ પત્રની જોશીસ. અમદાવાદ.

જમનાદાસ હીરાચંદ કુવાડ.

મોહાસા. (અમદાવાદ)

